

Power & Instrumentation (Guj.) Ltd.

AN ISO 9001: 2015 COMPANY

CIN: L32201GJ1983PLC006456

Date: 14-11-2024

To,

THE NATIONAL STOCK EXCHANGE OF INDIA LIMITED.

Exchange Plaza, Plot no. C/1, G Block, Bandra-Kurla Complex Bandra (E), Mumbai-400051

Scrip Symbol: PIGL

To, BSE Ltd.

Floor 25, P. J. Towers

Dalal Street,

Mumbai - 400 001

Scrip Code: 543912

SUB.: Newspaper Advertisement-Unaudited Financial Results of the Company for the Quarter ended on September 30, 2024

Dear Sir/ Ma'am,

Pursuant to Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please find attached the newspaper advertisement of the Unaudited Standalone and Consolidated Financial Results of the Company for the Second Quarter and Half year ended September 30, 2024 published in the Financial Express (Gujarati and English language) containing extract of Unaudited Financial Results as per regulation 33 of Securities and Exchange Board of India(Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.

Please take this on your record.

Yours faithfully,

For, POWER AND INSTRUMENTATION (GUJARAT) LIMITED

PADMARAJ PADMNABHAN PILLAI

Managing Director DIN: 00647590



SUNPOINT TRADING LIMITED

(Formerly known as Sun Finlease (Gujarat) Limited) (CIN L46109GJ1988PLC010293)

3, Ravipushpa Apartment, Opp. Sunset Raw House, Gurukul Road, Ahmedabad-380052.

Email: sfgl.1988@gmail.com • Website: sfgl.in.net; Tel. No. 079-27496313 EXTRACT OF STANDALONE UN-AUDITED FINANCIAL RESULTS FOR THE OUARTER AND HALF YEAR ENDED ON 30TH SEPTEMBER, 202

					(Rs. In lacs
Sr. No.	Particulars	Quarter er	nded	Half year Ended	Previous Year Ended
		30-09-2024 (Unaudited)	30-09-2023 (Unaudited)	30-09-2024 (Unaudited)	31-03-2024 (Audited)
1	Total income from Operation (Net)	-	2.42	1.69	3.68
2	Net Profit / (Loss) for the period (before tax exceptional and /or Extraordinary items)	(1.48)	(12.15)	(2.31)	(165.08)
3	Profit /(Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary item)	(1.48)	(12.15)	(2.31)	(165.08)
4	Profit / (Loss) for the period after tax (after Exceptional and /or Extraordinary item)	(1.48)	(12.15)	(2.31)	(158.51)
5	Total Comprihensive income for the period [Comprising profit /(Loss) for the period (after tax) and other comprehensive Income (after tax)]	1.48	(12.15)	(2.31)	(158.51)
6	Equity Share Capital	303.34	303.34	303.34	303.34
7	Earning per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations)				
	1. Basic	(0.05)	(0.40)	(0.08)	(5.23)
	2. Diluted	(0.05)	(0.40)	(0.08)	(5.23)

Place : Ahmedabad

Date: 13th, November, 2024

The above financial results have been taken on Record by the Resolution Professional on 13/11/2024 The Figures of the previous period have been regrouped. reclassified and restated wherever neces-

sary to make them comparable to current period.

The calculation of Income Tax & DTA/DTL will be made at the end of the year 4 On August 29, 2024, the Hon'ble NCLT, Ahmedabad Bench admitted the petition filed by a financial creditor for initiation of the CIRP Process and appointed Smt. CA Gomti Ramchandra Choudhary (Registration no. IBBI/IPA-001/IP-P-02625/2022-23/14275) as Interim Resolution Professional ("IRP" to carry out the functions entrusted by the provisions of the Insolvency and Bankruptcy Code, 2016, Rules and Regulations thereto.

In accordance with section 17 of the IBC, 2016, the powers of Board of Directors of the Company stand suspended effective from the CIRP Process commencement date and such powers along with the management of affairs of the Company are vested with CA Gomti Ramchandra Choudhary, Resolution professional ("RP")

Accordingly, your Company is presently undergoing CIRP under the provisions of the Code

For, Sunpoint Trading Limited

(Formerly Known as Sun Finlease (Gujarat) Limited)
Suspended Board of Director Bhargavi V. Talati

Chairperson and Director DIN: 03069724

Taken On Record CA Gomti Ramchandra Choudhary

Resolution Professional IBBI/IPA-001/IP-P-02625/2022-23/14275

પાવર એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન (ગુજરાત) લીમીટેડ

(CIN: L32201GJ1983PLC006456)

૨જીસ્ટર્ડ ઓફીસ : બી-૧૧૦૪, સંકલ્પ આઇકોનિક, વિક્રમ નગર સામે, ઇસ્કોન મંદિર ક્રોસ રોડ,

એસ.જી. હાઇવે, અમદાવાદ, અમદાવાદ ગુજરાત-૩૮૦૦૫૪, ભારત, ยभेยด : harshit@grouppower.org จิดสเตร : https:/power-instrumentation.grouppower.org/

૩૦ સપ્ટેમ્બર,૨૦૨૪ ના રોજપુરા થતાં ત્રિમાસિકના સંયુક્ત અનઓડિટેડ નાણાંકિય પરિણામોનો સાર

			ત્રિમાસિકના અંતે		છ માસિક	કના અંતે	વર્ષના અંતે
ક્રમ નં.	વિગતો	30.06.2028	30.05.2028	30.06.2023	30.06.2028	30.06.2023	39.03.2028
ا ^{م.}		(અનઓડિટેડ)	(અનઓડિટેડ)	(અનઓડિટેડ)	(અનઓડિટેડ)	(અનઓડિટેડ)	(ઓડિટેડ)
٩	કામકાજમાંથી કુલ આવક (ચોખ્ખી)	5574.53	2599.96	2452.09	8174.49	4662.15	9888.62
ą	ગાળાનો ચોખ્ખો નફો/(તોટો) (વેરા, અપવાદરૂપ						
	અને/અથવા અસાધારણ ચીજો પહેલા)	520.05	249.9	184.11	769.97	318.05	772.97
3							
	અને/અથવા અસાધારણ ચીજો પછી)	520.05	249.9	184.11	769.97	318.05	772.97
8	1						
	અને/અથવા અસાધારણ ચીજો પછી)	389.18	187.01	138.93	576.21	239.37	588.86
ч	ગાળાની કુલ સંયુક્ત આવક						
	(ગાળાના નફા /(તોટા) (વેરા પછી)						
	અને અન્ય સંયુક્ત આવક						
	(વેરા પછી) સહીત)	389.18	186.69	138.03	575.82	239.45	593.23
ξ	ઇક્વિટી શેર મુડી	1607.29	1263.39	1263.39	1607.29	1263.39	1263.39
ø	અનામતો (પુર્નમુલ્ચાંકિત અનામતો સિવાચની) પાછલા						
	વર્ષના ઓડિટેડ સરવૈયામાં દર્શાવ્યા મુજબ	_	-	-	_	-	-
۷	શેરદીઠ કમાણી (પ્રતિદિઠ રૂા. ૧/–ની)						
	(ચાલુ અને બંધ કામકાજો માટે)						
	મુળ:	2.69	3.7	1.09	3.99	1.9	4.7
	ઘટાડેલી:	2.69	3.7	1.09	3.99	1.9	4.7
	૩૦ સપ્ટેમ્બર,૨૦	્રક્ર ના	રોજપુર	ા થતાં ઉ	પ્રેમાસિક	ક્ના	
	-:		_				

	સંચુક્ત અનઓ	િ ટર્કરી	નાણાંકિર	ય પરિણ	ામોનો ર	ะแร	
			ત્રિમાસિકના અંતે		છમાસિક	વર્ષના અંતે	
ક્રમ નં.	વિગતો	30.06.2028	30.05.2028	30.06.2023	30.06.2028	30.06.903	39.03.2028
٩.		(અનઓડિટેડ)	(અનઓડિટેડ)	(અનઓડિટેડ)	(અનઓડિટેડ)	(અનઓડિટેડ)	(ઓડિટેડ)
٩	કામકાજમાંથી કુલ આવક	5,574.53	2,599.96	2,452.09	8,174.49	4,662.15	9,888.62
5	વેરા પુર્વે નફો	520.05	249.90	184.11	769.97	318.05	772.97
	વેરા પછી નફો (અન્ય વ્યાપક આવક પછી)	389.18	187.01	138.93	576.21	239.37	588.86

<u>નોંધ</u>: સેળી (લિસ્ટીંગ અને અન્ય ડિસ્કલોઝર રીકવાચરમેન્ટ્સ) નિયમનો, ૨૦૧૫ ના નિયમન ૩૩ હેઠળ સ્ટોક એક્સચેન્જોમાં ફાઇલ કરેલ ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ પુરા થતાં ત્રિમાસિકના ત્રિમાસિક નાણાંકિય પરીણામોની વિગતવાર માહિતીનો સાર ઉપર મુજબ છે. િત્રમાસિક અને છ માસિક નાણાંકિય પરિણામોની સંપુર્ણ માહિતી કુંધનીની વેબસાઇટ એટલે કે (www.grouppower.org) અને નેશનલ સ્ટોક એક્સરોર્જ ઓફ ઇન્ડિયા લીમીટેડની વેબસાઇટ (www.nseindia.com) અને મીએસઈ લીમીટેડ (www.bseindia.com) ઉપર ઉપલબ્ધ છે.

પાવર એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન (ગુજરાત) લીમીટેડ માટે

પદ્મરાજપદ્મનાભાન પિદ્યાદ

તા : ૧૩.૧૧.૨૦૨૪ મેનેજિંગ ડાયરેક્ટર ડીઆઇએન : ૦૦૬૪૭૫૯૦ થળ : અમદાવાદ

DCW

CIN : L24110GJ1939PLC000748 stered office : Dhrangadhra - 363315 (Gujarat) : 3^a Floor, 'Nirmal', Nariman Point, Mumbai - 400021

		Q	UARTER ENDE	D	HALF YEA	R ENDED	YEAR ENDED		
1	Particulars	30.09.2024	30.06.2024	30.09.2023	30.09.2024	30.09.2023	31.03.2024		
\perp		Unaudited	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Audited		
1.	Total Income from operations	48,873.72	49,952.42	41,408.76	98,826.14	85,212.91	1,87,158.98		
2.	Net Profit / (Loss) before tax for the period	(177.89)	1,014.54	447.65	836.65	1,979.99	2,534.17		
3.	Net Profit / (Loss) after tax for the period	(124.61)	672.80	266.05	548.19	1,265.07	1,565.96		
4.	Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	(124.61)	672.80	266.05	548.19	1,265.07	1,547.69		
5.	Equity Share Capital of face value of ₹ 2/- each.	5,903.10	5,903.10	5,903.10	5,903.10	5,903.10	5,903.10		
6.	Earning Per Share (of ₹ 2/- each) (for continuing and discontinued operations)								
	1. Basic	(0.04)	0.23	0.09	0.19	0.43	0.53		
_	2. Diluted	(0.04)	0.23	0.09	0.19	0.43	0.53		

NOTES .

The above is an extract of the detailed format of Financial Results for the quarter and half year ended on 30th September 2024 filed with the Stoci The above is an extract of the detailed format of Financial Nestris for the quarter and that year ended on 30° September 2024 filed with the Stock Exchanges under Regulation 30 of SEB (Listing and Discosure Requirements) Regulations, 2015. The full format of the Unaudited Financial Results for the quarter and half year ended on 30° September 2024 are available on the Stock Exchanges websites (www.bseindia.com, www.nseindia.com) and the

For and on behalf of the Board of Directors

Place : Mumbai Dated : 13th November, 2024

company website (www.dcwltd.com).

Bakul Jair Chairman & Managing Directo DIN: 00380256

(Formerly SAR Televenture Private Limited) CIN: L45202HR2019PLC080514

Regd. Off.: Plot No. 346 A, 2nd Floor, Udyog Vihar, Phase-4, Gurugram-122016 Haryana Contact: +91-8587050050, Email: info@sarteleventure.com

SAR Televenture Limited

EXTRACT OF STATEMENT OF CONSOLIDATE UNAUDITED FINANCIAL RESULTS FOR THE HALF YEAR ENDED 30.09.2024

	(Rs. in Lacs)										
	-	6 M	onths Ended	d on	Year Ended						
Sr. No.	Particulars	30.09.2024 Unaudited	30.09.2023 Unaudited	31.03.2024 Audited	31.03.2024 Audited	31.03.2023 Audited					
1	Total Income from Operations	11813.54	3581.49	8835.48	12416.97	3251.63					
2	Net Profit/(Loss) for the period (before Tax, Exceptional and/or extraordinary Items#)	1635.64	419.03	1187.57	1606.6	427.32					
3	Net Profit/(Loss) for the period before tax (after Exceptional and/or extraordinary Items#)	1635.64	419.03	1187.57	1606.6	427.32					
4	Net Profit/(Loss) for the period after tax (after Exceptional and/or extraordinary Items#)	1599.01	405.88	1160.29	1566.16	388.36					
5	Total Comprehensive Income for the period (Comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	1599.01	405.88	1160.29	1566.16	388.36					
6	Equity Share capital	742.85	210	300	300	65.29					
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	53068.71	2673.14	823.13	6880.43	1115.09					
8	Earning per Share (face Value of Rs. 10/- each) (not annualised)										
	1. Basic	4.31	5.09	11.94	16.12	91.08					
	2. Diluted	4.31	5.09	11.94	16.12	91.08					

The above is an extract of the detailed format of half year financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and other Disclosure Requirements) Regulations, 2015. The full format of the half year financial Results are available o the Stock Exchange website www.nseindia.com. The same is also available on the Company's website www.sarteleventure.com 2. The above results duly reviewed by the Audit Committee, were approved by the Board of Directors in their meeting held on 11.11.2024

For SAR Televenture Limited

Date: 11.11.2024 Place: Haryana

2. Diluted

Pankaj Nagpa

SAR Televenture Limited (Formerly SAR Televenture Private Limited) CIN: L45202HR2019PLC080514 Regd. Off.: Plot No. 346 A, 2nd Floor, Udyog Vihar, Phase-4, Gurugram-122016 Haryana Contact: +91-8587050050, Email: info@sarteleventure.com

EXTRACT OF STATEMENT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS

	FOR THE HALF YEAR ENDED 30.09.2024										
					(Rs	s. in Lacs)					
		6 M	onths Ended	d on	Year E	Ended					
Sr. No.	Particulars	30.09.2024 Unaudited		31.03.2024 Audited	31.03.2024 Audited	31.03.2023 Audited					
1	Total Income from Operations	538.46	321.94	320.74	640.97	642.99					
2	Net Profit/(Loss) for the period (before Tax, Exceptional and/or extraordinary Items#)	178.22	54.23	92.81	147.04	117.73					
3	Net Profit/(Loss) for the period before tax (after Exceptional and/or extraordinary Items#)	178.22	54.23	92.81	147.04	117.73					
4	Net Profit/(Loss) for the period after tax (after Exceptional and/or extraordinary Items#)	142.09	41.08	60.17	106.61	78.78					
5	Total Comprehensive Income for the period (Comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	142.09	41.08	60.17	106.61	78.78					
6	Equity Share capital	742.85	210	300	300	65.29					
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	49795.67	2673.14	5128.89	5128.89	823.13					
8	Earning per Share (face Value of Rs. 10/- each) (not annualised)										
	1. Basic	0.38	0.52	0.41	0.73	18.47					

NOTES: The above is an extract of the detailed format of half year financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and other Disclosure Requirements) Regulations, 2015. The full format of the half year financial Results are available or the Stock Exchange website www.nseindia.com. The same is also available on the Company's website www.sarteleventure.com The above results duly reviewed by the Audit Committee, were approved by the Board of Directors in their meeting held on 11.11.2024

0.38

0.52

0.41

0.73

18.47

Pankaj Nagpa Date: 11.11.2024 Place: Haryana

બોમ્બે ડાઇંગ એન્ડ મેન્યુફેક્ચરિંગે રૂા.૩૯૩ કરોડનો નફો નોંધાવ્યો

પીટીઆઇ

નવી દિલ્હી, તા. ૧૩ જમીનના

વેચાણમાંથી નફો થવાથી બોમ્બે એન્ડ મેન્યુફેક્ચરિંગ કંપની ડાઇંગ એન્ડ મેન્યુફેક્ચરિંગ કંપની લિમિટેડનો કુલ ખર્ચ ૨૪.૫૫ લિમિટેડે સપ્ટેમ્બર ૨૦૨૪ ટકા ઘટીને રૂા.૪૩૮.૪ કરોડ ત્રિમાસિક ગાળામાં રૂ થયો છે. ા.૩૯૩.૦૨ કરોડનો સંકલિત નફો નોંધાવ્યો છે. બોમ્બે ડાઇંગ એન્ડ મેન્યુફેક્ચરિંગ કંપની ૧૦.૩ ટકા ઘટીને રૂ લિમિટેડે પાછલા નાણાંકીય ા.૪૧૦.૧૫ કરોડ થયો છે.

વર્ષના સમાન સમય ગાળામાં રૂ ા.પ૨ કરોડની ચોખ્ખી ખોટ આવકરૂા.૧૧.૦૬ કરોડથઇ છે નોંધાવી હતી, એમ કંપનીએ એક જ્યારે તેના પોલિએસ્ટર નિયમનકારી યાદીમાં જણાવ્યું બિઝનેસમાંથી આવક હતું. કંપનીએ સપ્ટેમ્બર ા.૩૪૪.૧૯ કરોડ સામે વધીને ત્રિમાસિક ગાળામાં અપવાદરૂપ રૂા.૩૫૮.૪૫ કરોડ થઇ છે. ચીજવસ્તુઓ અને કર પહેલા રૂ રિટેલ-કાપડ બિઝનેસમાંથી ા.૨૮.૧૨ કરોડની ખોટ આવક રૂા.૧૧.૧૨ કરોડે નોંધાવી હતી. તેણે અપવાદરૂપ રહી છે.

ચીજવસ્તુનો ઉદ્ઘેખ કરતા રૂ ા.૫૦૧.૯૯ કરોડનો લાભ ટુકડાના નોંધાવ્યો હતો. બોમ્બે ડાઇંગ

> કંપનીની કુલ આવક સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં કંપનીની રિયલ્ટીમાંથી

એનએચસી ફુડ્સ લીમીટેડ

CIN: L15122GJ1992PLC076277

૨જીર્સ્ટક ઓફીસ : સર્વે નં. ૭૭૭, ઉમરસાડી દેસાઇવાડ રોડ, મુકામ ગામ ઉમરસાડી, તાલુકો-પારડી, કિલા પારડી, ગુજરાત-૩૯૬૧૭૫. **કોર્પોરેટ ઓફીસ** : ૪૧૯, ૪૨૦, સી વિંગ, અંતરીમ ૨૧૫, અંધેરી-કુર્લા રોડ, ચકલા, અંધેરી ઇસ્ટ, જે.બી. નગર, મુંબઇ-૪૦૦૦૫૯ ફોન નં. : ૦૨૨-૬૯૮૭૫૦૦૦**વેળસાઘટ :** www.nhcgroup.com **ઇ-મેઇલ:** grievances@nhcgroup.coi

પોસ્ટલ બેલોટની નોટીસ

આથી કંપની કાયદા, ૨૦૧૩ (કાયદા)ની કલમ ૧૦૮, કલમ ૧૧૦ અને અન્ય લાગુ જોગવાઈઓ, જો હોય તો, અને કંપની (વ્યવસ્થાપન અને પ્રશાસન) નિયમ, ૨૦૧૪ (નિયમો) સમયાનુંસાર સુધારેલ ના નિયમ ૨૦ અને નિયમ ૨૨, સાથે વંચાતા કોર્પોરેટ અફર્સ મંત્રાલય (એમસીએ) દ્વારા જારી કરાયેલ જનરલ સરક્યુલર નં. ૧૪/૨૦૨૦ તારીખ ૮ એપ્રિલ, ૨૦૨૦ જનરલ સરક્યુલર નં. ૧૭/૨૦૨૦ તારીખ ૧૩ એપ્રિલ ૨૦૨૦, જનરલ સરક્યુલર નં. ૨૨/૨૦૨૦ તારીખ ૧૫ જૂન

૨૦૨૦, જનરલ સટક્યુલર નં. ૩૩/૨૦૨૦ તારીખ ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૦,જનરલ સરક્યુલર નં. ૩૯/૨૦૨૦ તારીખ ૩૧ ડિસેમ્બર, ૨૦૨૦, જનરલ સરક્યુલર નં. ૧૦/૨૦૨૧ તારીખ ૨૩ જુન, ૨૦૨૧, જનર સરક્યુલર નં. ૨૦/૨૦૨૧ તારીખ ૮ ડિસેમ્બર, ૨૦૨૧ જનરલ સરક્યુલર નં. ૩/૨૦૨૨ તારીખ ૫ મે, ૨૦૨૨ જનરલ સરક્યુલર નં. ૧૧/૨૦૨૨ તારીખ ૨૮ ડિસેમ્બર, ૨૦૨૨, જનરલ સરક્યુલર નં. ૯/૨૦૨૩ તારીખ રપસપ્ટેમ્બર,૨૦૨૩(અંહી પછી એમસીએ પરિપત્રો તરીકે દર્શાવેલ છે) ઇન્સ્ટીટ્યુંટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓક ઇન્ડિયા દારા જારી કરાયેલ જનરલ મીટીંગ અંગેના સેક્રેટરીયલ સ્ટાન્ડર્ડ (એસએસ-૨). સેબી (લિસ્ટીંગ ઓબ્લીગેશન્સ અને ડિસ્ક્લોજર રીક્લાયરમેન્ટ્સ) નિયમનો, ૨૦૧૫ ના નિયમન ૪૪, અને . એક્ટ, નિયમો, અને તે હેઠળ જારી કરાચેલ સરક્યુલર્સ અને નોટીફીકેશનની અન્ય લાગુ જોગવાઈઓ (કોઈપણ સુધારા(ઓ), કાનુની ફેરફાર(રો) અને/અથવા લાગુ કરતી વખતે તેના પુર્ન અમલીકરણ સહીત) અન્વચે, ઇલેક્ટ્રોનિક માધ્યમો મારફત વોટીંગ (રીમોટ ઇ–વોટીંગ) ના માર્ગે પોસ્ટલ બેલોટ પોસ્ટલ બેલોટ) મારફત પાસ કરવા નિયત કરાયેલ નીચેના ઠરાવો માટે કંપનીના સભ્યોની મંજુરી માંગવા માટે નોટીસ આપવામાં આવે છે.

વિગતો	ઠરાવનો પ્રકાર
શ્રી સત્થમ જોષી (ડીઆઈએન: ૦૩૬૩૮૦૬૬) ની એક્ઝાયુટીવ ડાયરેક્ટર તરીકે નિમણુંક	સામાન્ય

એમસીએ પરિપત્રોના અનુપાલનમાં, કંપનીએ એવા સભ્યોને જેમના નામ અનુક્રમે શુક્રવાર, ૮ નવેમ્બર, ૨૦૨૪ (કટ–ઓફ તારીખ) ના રોજ વ્યવસાયના કલાકો પુરા થતાં મુજબ સભ્યોના રજ઼સ્ટર/લાભાર્થ માલિકો તરીકે કંપની/ડિપોઝીટરીઝ દ્વારા સચવાચેલ ચાદીમાં દેખાય છે અને જેમના ઇમેઈલ આઈડીઝ કંપની/ડિપોઝીટરી સહભાગી(ઓ) (ડીપી) પાસે નોંધાવેલા છે તેમને કંપનીએ પોસ્ટલ બેલેટ નોટીસની રવાનગી,માત્ર ઇલેક્ટ્રોનિક માધ્યમો દ્વારા બુધવાર,૧૩ નવેમ્બર,૨૦૨૪ના રોજપૂર્ણ કરી દીધી છે.પોસ્ટલ બેલોટ નોટીસ www.nhcgroup.com ખાતે કંપનીની વેબસાઈટ પર, www.bseindia.com ખાતે સ્ટોક એક્સરોન્જ એટલે કે બીએસઈ લિમિટેડની વેબસાઈટ ઉપર અને નેશનલ સિક્યોરીટીઝ ડિપોઝીટરી લિમિટેડ (એનએસડીએલ) ની વેબસાઈટ એટલે કે www.evoting.nsdl.com ખાતે ઉપલબ્ધ છે સભ્યો જેમના નામ કટ–ઓફ તારીખ મુજબ સભ્યોના રજ઼સ્ટર/લાભાર્થી માલિકોની યાદીમાં દેખાય છે તેમના મતદાન કરવાના અધિકારો કંપનીની ભરપાઈ થયેલ ઇક્વિટી શેર મુડીમાં તેમણે કટ–ઓક તારીખ મુજબ ધારણ કરેલા શેરોના પ્રમાણમાં નક્કી કરવામાં આવશે. વ્યક્તિ જે કટ–ઓફ તારીખ મુજબ કંપનીના સભ્ય નથી તેમણે પોસ્ટલ બેલેટની નોટીસનો ઉપયોગ માત્ર માહિતીના હેતુસર લેવાની રહેશે એમસીએ પરિપત્રો અંતર્ગત. કંપની કીઝીકલ પોસ્ટલ બેલોટ જમા કરવાને બદલે ઇલેક્ટોનિકલી તેન મત આપવા માટે તેના સભ્યોને ફક્ત રીમોટ ઈવોટીંગની સવલત પુરી પાડી રહી છે. સભ્યો ની સંમતિ અથવા અસંમતિની જાણ કક્ત રીમોટ ઇ-વોટીંગ પદ્ધતિ મારકત જ કરી શકાશે. કંપનીએ તેના તમામ સભ્યોને કક્ત ઇલેક્ટ્રોનિકલી તેમના મતો આપવા માટે રીમોટ ઈ-વોટીંગ સવલત પુરી પાડવા માટે એનએસડીએલની સેવાઓની નિમણુંક કરી છે. રિમોટ ઇ-વોટીંગ માટેની વિગતવાર પશ્ચિયા અને સચનાઓ પોસ્ટલ બેલેટ નોટીસમાં આપેલ છે. રિમોટ

ઇ-વોટીંગ ગુરુવાર, ૧૪ નવેમ્બર, ૨૦૨૪ ના રોજસવારે ૯.૦૦ વાગ્યે શરૂ થશે અને શક્રવાર, ૧૩ ડિસેમ્બર ૨૦૨૪ ના રોજ સાંજે ૫.૦૦ વાગ્યે પાર્ગ થશે. ઉપરોક્ત સમયગાળો પાર્ગ થયા પછી એનએસડીએલ દારા રિમોટ ઇ-વોટીંગ સવલત બંધ કરવામાં આવશે. સભ્યો, જેમણે તેમના ઇમેઈલ એડેસ રજસ્ટર્ડ કરાવેલ નથી, તેઓને ડિપોઝીટીરીમાં ઈલેક્ટોનિક હોલ્ડીંગના કિસ્સામાં લાગતા વળગતા ડિપોઝાટરી પાર્ટીશીપન્ટ(ટો) પાસે તે રજ઼સ્ટર્ડ કરાવા વિનંતી છે. બોર્ડ ઓક ડાયરેક્ટર્સે યોગ્ય અને પારદર્શક પદ્ધતિમાં ઇ-વોટીંગ પ્રક્રિયા મારકતે, પોસ્ટલ બેલોટ

કરાવવા માટે, સ્ક્રુટીનાઈઝર તરીકે વ્યવસાયિક કંપની સેક્રેટરી, સીએસ દિનેશ કુમાર દેઓરા (સભ્યપદ નં. એફપદ્૮૩ અને પ્રેક્ટીસનો સર્ટિફિકેટ નં. ૪૧૧૯) ની સ્ક્ટીનાઈઝર તરીકે નિમણુંક કરી છે. પોસ્ટલ બેલોટની ચોક્સાઈ અંગે સ્ફટીનાઈઝરનો નિર્ણય અંતિમ ગણાશે.

સ્ક્રટીનાઈઝર કંપનીના ચેરમેન અથવા તેમના દ્વારા અધિકૃત કરાચેલ કોઈપણ વ્યક્તિને તેમના પરિણામ સુપરત કરશે. પોસ્ટલ બેલોટ મતદાનના પરિણામો વોટીંગ સમયગાળો પુરા થયાના બે કામકાજન દિવસોમાં જાહેર કરવામાં આવશે. સ્કટીનાઈઝરનો અહેવાલ તેમજ પરિણામોની બીએસઈ લિમિટેડને જ્યાં કંપનીના શેરો લિસ્ટેડ છે જાણ કરવામાં આવશે. આ ઉપરાંત, પરિણામો કંપનીની વેબસાઈટ www.nhcgroup.com અને નેશનલ સિક્ચોરીટીઝ ડિપોઝીટરી લિમિટેડ (એનએસડીએલ) ની વેબસાઈટ www.evoting.nsdl.com પર પણ અપલોડ કરવામાં આવશે.

ફિક્વન્ટલી આસ્ક્ડ ક્વેશ્વન્સ (એફએક્યુઝ) નો અને સભ્યો માટેના ઇ-વોટીંગ યૂઝર મેન્યુઅલનો સંદર્ભ લઈ શકે છે.

કોઈપણ મદદ માટે. સભ્યો www.evoting.nsdl.com ના ડાઉનલોડ સેક્શનમાં ઉપલબ્ધ સભ્યો માટેના

તારીખ : ૧૩ નવેમ્બર, ૨૦૨૪

સ્થળ : મુંબઇ

એનએચસી કૂડ્સ લીમીટેડ માટે સહી/-અપૂર્વા શાહ મેનેજિંગ ડાંચરેક્ટર ડીઆઈએન નં. : ૦૦૫૭૩૧૮૪



The Sandur Manganese & Iron Ares Limited

Registered Office: 'Satyalaya', Door No.266 (Old No 80), Ward No.1, Behind Taluka Office Palace Road, Sandur - 583 119, Ballari District CIN:L85110KA1954PLC000759; Website:www.sandurgroup.com; Email Id:secretarial@sandurgroup.com

STATEMENT OF STANDALONE AND CONSOLIDATED UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF YEAR ENDED 30 SEPTEMEBER 2024

													₹ in lakh
				Standalone fi	nancial results					Co	nsolidated financial result	is	
SI.	Particulars	Quarter ended	Preceding quarter ended	Corresponding quarter ended in the previous year	Year to date figures for half year ended	Corresponding half year ended in the previous year	Previous year ended	Quarter ended	Preceding quarter ended	Corresponding quarter ended in the previous year	Year to date figures for half year ended	Corresponding half year ended in the previous year	Previous year ended
NO.		30 September 2024	30 June 2024	30 September 2023	30 September 2024	30 September 2023	31 March 2024	30 September 2024	30 June 2024	30 September 2023	30 September 2024	30 September 2023	31 March 2024
		(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Audited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Audited)
1	Total income from operations	28,508	62,446	20,233	90,954	58,318	1,33,366	28,540	62,473	20,262	91,013	58,367	1,33,480
2	Net profit for the period/ year (before tax, exceptional and/ or extraordinary items)	4,315	19,557	3,555	23,872	9,195	32,417	4,345	19,581	3,579	23,926	9,239	32,502
3	Net profit for the period/ year after tax (after exceptional and/or extraordinary items)	3,212	14,635	2,635	17,847	6,615	23,801	3,214	14,449	2,698	17,663	6,676	23,946
4	Total comprehensive income for the period/ year [Comprising profit for the period (after tax) and other comprehensive income (after tax)]	3,164	14,635	2,643	17,799	6,435	23,663	3,166	14,449	2,706	17,615	6,496	23,808
5	Paid-up equity share capital (Face value of ₹ 10/- each)	16,204	16,204	2,701	16,204	2,701	16,204	16,204	16,204	2,701	16,204	2,701	16,204
6	Other equity (including reserves)				-		1,99,490						1,99,623
7	Earnings per share (of $\ref{thmodel}$ 10/- each) (for continuing and discontinued operations) - (not annualised)												
	1. Basic:	1.98	9.03	1.63	11.01	4.08	14.69	1.98	8.92	1.67	10.90	4.12	14.78
	2. Diluted:	1.98	9.03	1.63	11.01	4.08	14.69	1.98	8.92	1.67	10.90	4.12	14.78

- 1. The above is an extract of the detailed unaudited financial results for the quarter and half year ended 30 September 2024 filed with Stock Exchange under Regulation 33 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. Full format of Standalone and Consolidated financial results for the quarter and half year ended 30 September 2024 is available on the Stock Exchange website (www.bseindia.com and www.nseindia.com) and on the Company's website
- 2. These unaudited financial results have been prepared in accordance with Indian Accounting Standards ('Ind AS') prescribed under Section 133 of the Companies Act, 2013 read with relevant rules issued thereunder and in terms of the Listing Regulations, as modified by Circular No. CIR/CFD/FAC/62/2016 dated 5 July 2016. 3. Subsequent to signing of the Share Purchase Agreement (SPA) on 25 April 2024 for the strategic business acquisition of Arjas Steel Private Limited (ASPL), the Board of Directors of the Company in its meeting held on 4 November 2024 have approved the acquisition of additional 20% of equity shares (in one or more tranches), thereby approving, in aggregate, acquisition of Arjas Steel Private Limited (ASPL), the Board of Directors of the Company in its meeting held on 4 November 2024 have approved the acquisition of additional 20% of equity shares (in one or more tranches), thereby approving, in aggregate, acquisition of Arjas Steel Private Limited (ASPL), the Board of Directors of the Company in its meeting held on 4 November 2024 have approved the acquisition of additional 20% of equity shares (in one or more tranches), thereby approving, in aggregate, acquisition of Arjas Steel Private Limited (ASPL), the Board of Directors of the Company in its meeting held on 4 November 2024 have approved the acquisition of Arjas Steel Private Limited (ASPL), the Board of Directors of the Company in its meeting held on 4 November 2024 have approved the acquisition of Arjas Steel Private Limited (ASPL), the Board of Directors of the Company in its meeting held on 4 November 2024 have approved the acquisition of Arjas Steel Private Limited (ASPL), the Board of Directors of the Company in its meeting held on 4 November 2024 have approved the acquisition of Arjas Steel Private Limited (ASPL).
- Pursuant to the said approval, the Company has amended the SPA on 4 November 2024 to acquire 99.12% of the equity shares of ASPL. On obtaining all required approvals, the Company has completed acquisition of 98.94% equity shares of ASPL on 11 November 2024 4. The Company has on 1 September 2024 received Environmental Clearance (EC) from Ministry of Environment, Forest and Climate Change (MoEFCC) for Iron Ore production of 0.216 Million Tonnes Per Annum (MTPA) by retaining the existing Manganese Ore production of 0.05 MTPA along with handling of 0.327 Million Tonnes of already stocked incidental Iron Ore in its Ramghad Manganese & Iron Ores mines. Subsequent to the receipt, the Company has made an application to Karnataka State Pollution Control Board (KSPCB) for grant of Consent For Establishment (CFE) for Iron Ore production enhancement, which is under active consideration
- 5. The Company has on 18 September 2024 received Consent For Operation (CFO-Expand) from Karnataka State Pollution Control Board (KSPCB) for enhancement in Manganese Ore production from 0.462 MTPA to 0.582 MTPA. Subsequent to the receipt of the CFO-Expand and all the requisite statutory approvals, the Company's Manganese Ore Maximum Permissible Annu
- 7 Subsequent to the period ended 30 September 2024, the Company has issued and allotted 45,000 secured, Non-Convertible Debentures (NCDs) of ₹1,00,000/- each aggregating to ₹45,000 lakh on private placement basis bearing 11% interest. These debentures were listed on BSE Limited on 28 October 2024. Since, the debentures are listed post the quarter and half year ended 30 September 2024, the additional disclosures as per Regulation 52(4) of the SEBI (Listing Obligations and Disclosure Requirements) will be published in the financial results from the subsequent quarter
- 8 During the year ended 31 March 2024, pursuant to the approval of the shareholders of the Company on 20 January 2024, the Company on 20 January 2024, the Company had allotted 13,50,29,115 equity shares of ₹10/- each as bonus shares to shareholders who held equity shares as on the record date of 2 February 2024. Accordingly, earnings per share for the quarter and half year ended on 30 September

6 The Board of Directors of the Company proposed dividend of ₹ 1 per equity share of ₹ 10 each amounting to ₹ 1,620 lakh for the year ended 31 March 2024, which was approved at the Annual General Meeting of the Company held on 18 September 2024. The aforesaid dividend was paid during the quarter resulting in a cash outflow of ₹ 1,620 lakh.

9 Previous period figures have been regrouped/ reclassified to confirm with the classification adopted in these unaudited financial results.

for and on behalf of the Board of Directors

Sd/-BAHIRJI A. GHORPADE Managing Director

13 November 2024

Equitas Small Finance Bank Ltd

(FORMERLY KNOWN AS EQUITAS FINANCE LTD) Registered Office: No.769, Spencer Plaza, 4th Floor, Phase-II, Anna Salai, Chennai - 600002.

SALE NOTICE FOR THE SALE OF IMMOVABLE PROPERTY

E-Auction Sale Notice for the sale of immovable assets under SARFAESI Act, 2002, R/w rule 8(6) of Security Interest (Enforcement) Rules, 2002.

Notice is hereby given to the public in general and in particular to the Borrowers. Co borrowers and Guarantors that the below described immovable property mortgaged to the Secured creditor, the physical possession of which has been taken by the Authorised Officer of Equitas Small Finance Bank Ltd., will be sold on 30-11-2024 "AS IS WHERE IS" "AS IS WHAT IS CONDITION" for recovery of below mentioned amount due to Equitas Small Finance Bank Ltd., from the following borrowers.

Borrower/s & Guarantor/s Name & Address Total Due + Interest from	Description of the Immovable Property
HIRABHAI 2.MRS.ASHABEN TULSIBHAI NADIYA,W/O. TULSIBHAI Both are residing at 192 Nadiyavas, Moyas, Ravalvasni Bajumaa,Moyan, Mehsana,Gujarat - 382715. Loan Account No SEMEHSN0243414 Claim Amount Due Rs.157348/- as on 29-09-2023 with further interest from 30-09-2023 with monthly rest, charges and costs, etc., (Total Outstanding beingRs.	Item -1 All the piece and parcel of the being grampanchayat property no-179 are known as nadiyavas of Mouje: Moyan Taluka: Jotana Dist: Mehsana admeasuring around length 60 ft width 14 ft Total 840 sq ft. North by: House of Nadiya Ramabhai Somabhai South by: House of Dayabhai Hirabhai East by: Road Westy: Road Measurement: 840 Sq.ft Situated at within the Sub-Registration District of Jotanaand Registration District of Mehsana. Together with all buildings and structure attached to the earth or permanently fastened to anything attached to earth, both present and future and all easamentary / mamool rights annexed thereto. Reserve Price: Rs. 5,11,200/-, Earnest Money Deposit: Rs. 51,120/-Contact Names: Javed Kothariya: 7874234782, Irshadkhan Pathan: 9904068086
Da	ate of Auction: 30-11-2024

For detailed terms and conditions of the E-Auction sale, please refer to the link provided in

www.equitasbank.com & https://www.bankeauctions.com Date - 14.11.2024, Place - Mehsana **Authorized officer, Equitas Small Finance Bank Ltd**

POWER AND INSTRUMENTATION (GUJARAT) LIMITED (CIN:L32201GJ1983PLC006456)

Regd. Office: B-1104 Sankalp Iconic, Opp Vikram Nagar, Iscon Temple Cross Road, S. G. Highway, Ahmedabad, Gujarat, India, 380054

E-mail: harshit@grouppower.org | Website: https://power-instrumentation.grouppower.org/ EXTRACT OF CONSOLIDATED UN-AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED SEPTEMBER 30, 2024

		(QUARTER END	DED	HALF YEA	IR ENDED	YEAR ENDED
SI Vo.	Particulars	30.09.2024	30.06.2024	30.09.2023	30.09.2024	30.09.2023	31.03.2024
W.	11/26/10/8/14/8	(Un-audited)	(Un-audited)	(Un-audited)	(Un-audited)	(Un-audited)	(Audited)
1.	Total income from operations (net)	5574.53	2599.96	2452.09	8174.49	4662.15	9888.62
2.	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	520.05	249.9	184.11	769.97	318.05	772.97
3.	Net Profit / (Loss) for the period before tax (after Exceptional &/or Extraordinary items)	520.05	249.9	184,11	769.97	318.05	772.97
4.	Net Profit / (Loss) for the period after tax (after Exceptional &/or Extraordinary items)	389.18	187.01	138.93	576.21	239.37	588.86
5.	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	389.18	186.69	138.03	575.82	239.45	593.23
6.	Equity Share Capital	1607.29	1263.39	1263.39	1607.29	1263.39	1263.39
7.	Reserves (excluding Revaluation Reserve as shown in the Balance Sheet of previous year)		50 Carristo	55	*5	9.43	E E
8.	Earnings Per Share (of Rs.1/- each) (for continuing and discontinued operations)	*******		7.29000	0423420	280-00	900
	Basic:	2.69	3.7	1.09	3.99	1.9	4.7
	Diluted:	2.69	3.7	1.09	3.99	1.9	4.7

~	Particulars	(QUARTER END	ED	HALF YEA	YEAR ENDED	
SI No.		30.09.2024 (Un-audited)	30.06.2024 (Un-audited)	30.09.2023 (Un-audited)	30.09.2024 (Un-audited)	30.09.2023 (Un-audited)	31.03.2024 (Audited)
1.	Total income from operations	5,574.53	2,599.96	2,452.09	8,174.49	4,662.15	9,888.62
2.	Profit Before Tax	520.05	249.90	184.11	769.97	318.05	772.97
3.	Profit After Tax (Afer Other Comprehensive Income)	389.18	187.01	138.93	576.21	239.37	588.86

Note: The above is an extract of the detailed format of Quarterly Financial Results for the Quarter ended on September 30, 2024 filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, he full format of the Quarterly and Half yearly Financial Results are available on the the website of the Company (www.grouppower.org) and on the website of National Stock Exchange of India Limited, (www.nseindia.com) and BSE Limited (www.bseindia.com)

For POWER AND INSTRUMENTATION (GUJARAT) LIMITED

PADMARAJ PADMNABHAN PILLAI MANAGING DIRECTOR Date: 13.11.2024 Place: AHMEDABAD (DIN: 00647590)

Branch: - 10,11,12, Ground Floor, The Grand Monarch Complex, 100

Fit Road, Near Seema Hall, Satellite, Ahmedabad, Pin Code - 380 015. Ph.079-26765290/91 Email. tjsb.118@tjsb.co.in

Registered Office: - TJSB House, Plot No. B5, Road No. 2, Wagle Industrial Estate, Thane (West) - 400 604. Ph. 022-2587 8500

POSSESSION NOTICE

The undersigned being the Authorized officer, of Guarantor) (9) Mrs. Ningoo Aarti Chandrasen -

the said notice. The borrowers having failed to repay the amount, notice is hereby given to the borrowers and the public notice is hereby given to the borrowers and the public 13(4) of the said Act read with rule 8 of the Security 13(4) of the said Act read with rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002 on this the 9th day of November of the year 2024.

The Borrowers, Guarantors & Mortgagors in particular and the public in general is hereby cautioned | particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealing with the not to deal with the property and any dealing with the property will be subject to the charge of TJSB Sahakari property will be subject to the charge of TJSB Sahakari Bank Ltd., Manjalpur Branch, for an amount Bank Ltd., Manjalpur Branch, for an amount Rs.1,98,04,201.38 (Rupees One Crore Ninety Eight Rs.2,30,68,320.85 (Rupees Two Crore Thirty Lac Sixty-Lacs Four Thousand Two Hundred One and Thirty-Eight | Eight Thousand Three Hundred Twenty and Eighty-Five Paisa Only) as on 30-09-2024 + interest, charges, Paisa Only) as on 31-10-2024 + interest, charges, expenses etc. Thereon.

The undersigned being the Authorized officer, of TJSB Sahakari Bank Ltd; under the Securitization and TJSB Sahakari Bank Ltd; under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Reconstruction of Financial Assets and Enforcement of Security Interest (Act, 2002 (54 of 2002) and in exercise | Security Interest (Act, 2002 (54 of 2002) and in exercise of powers conferred under Section 13(12) read with of powers conferred under Section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002, issued a demand notice dated 08-02-2024 calling 2002, issued a demand notice dated 08-02-2024 calling upon (1) M/s. Chanderdip Processor, A partnership upon (1) M/s. SGS Innovations, (Borrower) - A Firm through its Partners - (Borrower & Mortgagor) at partnership Firm Through its Partners, at 856/18 856/18 G.I.D.C, Makarpura, Vadodara -390001, and G.I.D.C, Makarpura, Vadodara -390001, and calling calling upon to (2) Mrs. Ningoo Chitra Bholanath - upon to (2) Mrs. Ningoo Chitra Bholanath - (Partner, (Partner, Mortgagor & Guarantor) (3) Mr. Ningoo Mortgagor & Guarantor) (3) Mr. Ningoo Kamal Kamal Bholenath - (Partner & Guarantor) (4) Mrs. Bholenath - (Partner & Guarantor) (4) Mrs. Ningoo Ningoo Kajal Kamal - (Partner & Guarantor) at C-8, Kajal Kamal - (Partner & Guarantor) at C-8, Vrajdham Vrajdham Soc, Sussen tarsal Ring Road, ONGC Col, Soc, Sussen tarsali Ring Road, ONGC Col, Vadodara Vadodara -390009, and calling upon to (5) Mr. Ningoo | 390009, and calling upon to (5) Mr. Ningoo Deepak Deepak Bholanath - (Partner & Guarantor) (6) Mrs. | Bholanath - (Partner & Guarantor) (6) Mrs. Ningoo Ningoo Hemna Deepak – (Partner & Guarantor) at C-7, Hemna Deepak – (Partner & Guarantor) at C-7, Vrajdham Soc, Sussen tarsal Ring Road, ONGC Col, Vrajdham Soc, Sussen tarsali Ring Road, ONGC Col, Vadodara -390009, and calling upon to (7) Mr. Ningoo Vadodara -390009, and calling upon to (7) Mr. Ningoo Mukundkumar Chandersen – (Partner & Guarantor) | Mukundkumar Chandersen – (Guarantor) (8) Mrs. (8) Mrs. Ningoo Archita Chandrasen - (Partner & Ningoo Archita Chandrasen - (Guarantor) (9) Mrs. Ningoo Aarti Chandrasen - (Guarantor), at A-1 (Partner & Guarantor), at A-1, Panghat Park 11, Near Panghat Park 11, Near Goyagat Soc, Pratapnagar, Goyagat Soc, Pratapnagar, Vadodara -390004 and Vadodara -390004 and calling upon to (10) M/s. calling upon to (10) M/s. SGS Innovations - Chandradip Processor - (Mortgagor & Guarantor) at (Guarantor) at 856/18 G.I.D.C, Makarpura, Vadodara - 856/18 G.I.D.C, Makarpura, Vadodara -390001, to 390001, to repay the amount mentioned in the notice repay the amount mentioned in the notice being being Rs.1,83,48,551.18 (Rupees One Crore Eighty Rs.2,08,27,299.75 (Rupees Two Crore Eight Lac Three Lacs Forty Eight Thousand Five Hundred Fifty Twenty-Seven Thousand Two Hundred Ninety-Nine One and Eighteen Paisa Only) + interest, charges, and Seventy-Five Paisa Only) + interest, charges, expenses etc. within 60 days from the date of receipt of expenses etc. within 60 days from the date of receipt of the said notice.

The borrowers having failed to repay the amount, n general that the undersigned has taken Physical in general that the undersigned has taken Physical Possession of the property described herein below in Possession of the property described herein below in exercise of powers conferred on him under Section exercise of powers conferred on him under Section Interest (Enforcement) Rules, 2002 on this the 9th day of November of the year 2024.

The Borrowers, Guarantors & Mortgagors in expenses etc., Thereon.

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of ime available, to redeem the secured assets.

DESCRIPTION OF IMMOVABLE PROPERTY (1) Property stands in the name of M/s. Chanderdip Processor – A Partnership Firm

All that plotted area admeasuring 802.38 sq. mtrs. or thereabout designated as plot no. 856/18 in the Makarpura Industrial Estate. GIDC Makarpura, Vadodara lying being and situated on land bearing Rev.S.No.675/P, 707/P of Village: Vadsar Ta & Dist: Vadodara. Property bounded as under.

> On or towards North: By 80.00 wide road On or towards South: By Boundary of A.B.B.

On or towards East : By Plot no.855 On or towards West : By Plot no. 857

DESCRIPTION OF MOVABLE ASSETS

(2) Movable Assets in the name of M/S. Chanderdip Processor: Hypothecation of Stock & Book Debts and Plant & Machinery in the name of M/S. Chanderdip Processors Situated at 856/18 G. 1 .D.C, Makarpura, Vadodara - 390001

(3) Movable Assets in the name of M/S. SGS Innovations: Hypothecation of Stock and Book Debts and Machinery in the name of M/s. SGS Innovations Situated at 856/18 G 1.D.c, Makarpura, Vadodara-390001

SEAL

Date: 09/11/2024 Place: Vadodara



Authorized Officer: TJSB Sahakari Bank Ltd., Under SARFAESI Act, 2002. **EMMBI INDUSTRIES LIMITED**

Regd. Off.: 99/2/1 & 9, Madhuban Industrial Estate, Madhuban Dam Road, Rakholi Village,

U. T. of Dadra & Nagar Haveli, Silvassa - 396230 Tel: +91 22 4672 5555, Fax: +91 22 4672 5506; Email: info@emmbi.com, Website: www.emmbi.com

Extract of Consolidated Unaudited Financial Results For the Quarter and Half Year Ended 30th September, 2024 Pursuant to Regulation 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015

					₹ In Milli	ons (Except pe	er share data)
		3 months	Preceeding	Corresponding	Year to date	Year to date	For the
Sr.	PARTICULARS	ended	3 months	3 month	figures for	figures for	year ended
No.			ended	ended	current	previous	
					period from		
					01/04/2024 to		
			30/06/2024			30/09/2023	31/03/2024
		Unaudited	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Audited
1	Total Revenue from Operations	1,197.96	i -	<u> </u>	2,267.91	. 8	
2	Net Profit / (Loss) for the period						
	(before Tax, Exceptional and/ or Extraordinary items#)	21.93	-	-	42.18	<u> </u>	
3	Net Profit / (Loss) for the period before tax			,		- 0	
	(after Exceptional and/orExtraordinary items#)	21.93	-	-	42.18		-
4	Net Profit / (Loss) for the period after tax						
	(after Exceptional and/orExtraordinary items#)	15.74	-	-	30.62	-	-
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for					70	
	the period (after tax) and Other Comprehensive Income (after tax)]	15.74	-	-	30.62		_
6	Equity Share Capital	176.90	-	-	176.90	-	
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the	i i			1	= =	
	Audited Balance Sheet of the previous year.		_	_		-	_
8	Earnings Per Share (of Rs. 10/- each)					1	
	(for continuing and discontinued operations) -						
	1. Basic:	0.89	-		1.73		
	2. Diluted:	0.82	0 -		1.59	1	-

₹ In Millions (Except per share data										
Q V		3 months	Preceeding	Corresponding	Year to date	Year to date	For the			
Sr.	PARTICULARS	ended	3 months	3 month	figures for	figures for	year ende			
No.			ended	ended	current	previous				
					•	period from				
					01/04/2024 to	l				
		30/09/2024	30/06/2024	30/09/2023	30/09/2024		31/03/2024			
		Unaudited	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Audited			
1	Total Income from Operations	1,197.96	1,069.96	1,116.64	2,267.91	2,124.41	4,425.43			
2	Net Profit (Loss) for the period year before tax									
	(after Exceptional and or Extraordinary items)	23.48	20.25	25.73	43.73	46.34	98.02			
3	Net Profit (Loss) for the period year after tax	-	ř i	3	1	- 2				
	(after Exceptional and or Extraordinary items)	17.29	14.89	16.13	32.17	30.66	99.47			
4	Total Comprehensive Income for the period					, , , , , , , , , , , , , , , , , , ,				
	[Comprising Profit / (Loss) for the period (after tax) and									
	Other Comprehensive Income (after tax)]	17.29	14.89	15.63	32.17	29.66	101.10			
Not	es:	7.4	7.7.	17 2	3	i 27				
	The Unaudited Financial Results have been reviewed and recomr	mended by Audit C	committee an	d approved b	v the Board	of Directors i	n its meetin			

(Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly/half yearly Financial Results are available on the websites of the Stock Exchange(s) www.bseindia.com and www.nseindia.com and the website of the Company www.emmbi.com.

#- Exceptional and/or Extraordinary items adjusted in the Statement of Profit and Loss in accordance with Ind-AS Rules /AS Rules, whichever is applicable. Subsidiary company, Zastian PTE. Limited, was newly incorporated during the current period. Accordingly, the requirement for comparative information for previous period is not applicable.

For and on behalf of the Board. For Emmbi Industries Limited **Makrand Appalwar**

6.73

13.68

(Managing Director)

DIN: 00171950

Date: 13th November, 2024



CIN:L24231GJ1992PLC017315

Regd. Office:PLOT NO 1504/1505/1506/1 GIDC, PHASE-III, VAPI, Valsad-396195, Gujarat, India, Tel. No.: +91 260 240 1646 Corporate Office: 2Nd Floor, A Wing, Fortune Avirahi, Jain Derasar Road, Borivali-West, Mumbai-400092, Tel. No.: +91 22 28987912

STATEMENT OF STANDALONE AND CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON SEPTEMBER 30, 2024													
	[Standalone Consolidated											
Sr.	Particulars	Quarter ended			Half Year ended Year en		Year ended	d Quarter ended			Half Year ended		Year ended
No.		30-Sep-24	30-Jun-24	30-Sep-23	30-Sep-24	30-Sep-23	31-Mar-24	30-Sep-24	30-Jun-24	30-Sep-23	30-Sep-24	30-Sep-23	31-Mar-24
		Reviewed	Reviewed	Reviewed	Reviewed	Reviewed	Audited	Reviewed	Reviewed	Reviewed	Reviewed	Reviewed	Audited
Ĩ.	Total Income from Operations	470.34	313.54	434.76	783.88	725.06	1,305.14	440.48	297.39	426.13	737.87	707.13	1,270.90
Ш	Profit before Tax (I-II)	46.93	46.76	43.97	93.69	46.00	90.39	42.94	23.63	37.81	66.57	31.64	52.24
Ш	Total Tax Expenses	12.98	12.31	11.46	25.28	11.98	24.04	5.27	7.01	10.90	12.29	10.34	17.74
IV	Profit for the Year after Taxes (III-IV))	33.96	34.45	32.51	68.41	34.02	66.35	37.66	16.62	26.91	54.28	21.30	34.50
V	Total Comprehensive Income for the period (V+VI)	33.76	34.45	32.57	68.21	34.11	66.33	37.60	16.62	26.96	54.21	21.38	34.50
VI	Paid up Equity Share Capital												
l	(Face value of Rs.10 Each fully paid up)	40.01	40.01	40.01	40.01	40.01	40.01	40.01	4.01	40.01	40.01	40.01	40.01
VII	Other Equity					837.45						803.05	
VIII	Earning per share (of Rs. 10 each) (not annualised)												
	(a) Basic	8.49	8.61	8.12	17.10	8.50	16.58	9.49	4.19	6.73	13.68	5.32	8.72

Notes:

Place: Mumbai

Date: November 13, 2024

(b) Diluted

The above financial results as reviewed by the Audit Committee, were approved and taken on record by the Board of Directors in their meeting held on November 13, 2024.

The statutory auditors have carried out a limited review of the financial results for the Quarter and Half year ended September 30, 2024 and have issued their unmodified report thereon. The standalone financial results of Heranba Industries Limited (the Company) have been prepared in accordance with Indian Accounting Standards (Ind AS) notified under the Companies (Indian Accounting Standards) Rules,

8.12

2015 (as amended) and in terms of regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure requirements), 2015 as amended. The Board of Directors of the Company at their meeting held on May 27, 2023 had recommended dividend of 1.25 per share (12.5% of FV-Rs.10) on the outstanding equity shares of nominal value of Rs. 10/- each as on record

17.10

8.50

16.58

9.49

date. The said dividend was approved by the shareholders in the Annual General Meeting of the Company held on September 12, 2024 and has since been paid out.

5 The company is engaged in manufacture and sale of Agro Chemical business. As the Company's business activity falls within a single business segment, there is no separate reportable segment as per Ind AS 108 "Operating

Figures for the previous period have been regrouped / re-classified to confirm to the figures of the current period.

8.49

By Order of the Board For Heranba Industries Limited Raghuram K Shetty Managing Director DIN-00038703

5.32

8.72

Place: Mumbai

TGB BANQUETS AND HOTELS LIMITED

CIN: L55100GJ1999PLC036830

Regd. Office: "The Grand Bhagwati", Plot No. 380, S.G. Road, Bodakdev, Ahmedabad - 380054 E-mail: info@tgbhotels.com Website: www.tgbhotels.com Tel. 079-26841000


THE GRAND BHAGWATI EXTRACT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FORTHE QUARTER AND HALFYEAR ENDED ON 30TH SEPTEMBER. 2024

(Rs In lakhs except EPS)										
		Standalone								
		3	Quarter End	ded	HalfYear	Year Ended				
Sr. No.	Particulars	30.09.2024	30.06.2024	30.09.2023	30.09.2024	30.09.2023	31.03.2024			
		Unaudited	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Audited			
1	Total Income from Operation (net)	882.42	736.45	912.03	1618.87	1703.78	4,026.01			
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	21.07	13.59	17.98	34.66	34.79	-354.20			
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	21.07	13.59	17.98	34.66	34.79	-354.20			
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	21.07	13.59	17.98	34.66	34.79	-356.01			
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax and other comprehensive)	21.07	13.59	17.98	34.66	34.79	-348.53			
6	Equity Share Capital (Face Value of Rs. 10 each)	2928.64	2928.64	2928.64	2928.64	2928.64	2928.64			
7	Other Equity						-]			
8	Earnings Per Share (of Rs. 10/- each) for continuing / discontinuing operation					10				
	1) Basic	0.07	0.05	0.06	0.12	0.12	-1.22			
	2) Diluted	0.07	0.05	0.06	0.12	0.12	-1.22			
Notes:	·····									

The above is an extract of the detailed format of Standalone Financial Results for the Quarter and half year ended on 30th September 2024 filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulation, 2015. The full format of the Standalone Financial Results for the Quarter and half year ended on 30th September 2024 are available on the Stock Exchange websites i.e. www.nseindia.com, www.bseindia.com and on the company's website www.tgbhotels.com.

> For, TGB Banquets and Hotels Limited Narendra G. Somani **Chairman & Managing Director** (DIN: 00054229)





financialexp.epapr.in

Place: Ahmedabad

Date: November 13,2024